

Tuesday, September 10, 2019

To,

Bombay Stock Exchange Ltd
Corporate Relationship Department
1st Floor, New Trading Ring,
Rotunda Building, P.J. Towers,
Dalal Street, Fort, Mumbai- 400001
(Scrip Code No: 500418)

National Stock Exchange of India Ltd
Exchange Plaza, C-1, Block G,
Bandra Kurla Complex,
Bandra (E), Mumbai – 400 051
(Scrip Code: Tokyo Plast)

Sub: Copy of Advertisement Published in Newspaper- Notice of AGM, Book Closure and Remote E-voting


Dear Sir/Madam,

Pursuant to the provisions of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015, enclosed copies of advertisement published in Free Press Journal (English) & Divya Bhaskar (Gujarati) newspaper on 8th September, 2019 for Notice of AGM, Remote E-Voting information & Book Closure.

Kindly take the same in your records.

Thanking You,

For Tokyo Plast International Limited


Haresh V. Shah
Director
DIN: 00008339

TOKYO PLAST *International Ltd.*

ADMIN. OFFICE : Vyom Arcade, 5th Floor, Tejpal Scheme Road No.5, Above United Bank of India, Vile Parle (East), Mumbai - 400 057, India.
Tel. : 91-22-6145 3300/6695 2301 • Fax: 91-22-6691 4499 • E-mail: info@tokyoplast.com • Website: www.tokyoplast.com
REGD. OFFICE : Plot No. 363/1, (1,2,3) Shree Ganesh Industrial Estate, Kachigaum Road, Daman - 396 210 (U.T.)
Tel. : (0260) 2242977 / 2244471 • Fax: (0260) 2243271 • CIN - L25209DD1992PLC009784

VAISHALI PHARMA LIMITED

5 to 709, 7th Floor, Aravali Business Center, Jawala Lane, Borivali (W), Mumbai - 400092. CIN: L52310MH2008PLC181632
 Email: investor@vaishalipharma.com
 www.vaishalipharma.com

THE MEMBERS

Annual General Meeting (AGM) of the Members of Vaishali Pharma Limited is scheduled to be held on Monday, 23rd September, 2019 at 706 to 709, Jawala Lane, Off Sodawala Lane, Borivali (West), Mumbai - 400092 to transact such Ordinary business as set out in the Notice.

The Financial year 2018 - 19 has been sent to the Members by electronic mode on September 27, 2019 available on the website of the Company.

Facility to its members. Members may cast their vote from a place other than the venue of the AGM. The Company has engaged the services of Karvy Fintech Private Limited to provide e-voting facility. The facility for e-voting is available at the AGM.

The Register of Members / Beneficial Owners of the Company will remain closed from Tuesday, 24th September 2019 to Monday, 30th September 2019 (both days inclusive).

It is also notified that the 34th Annual General Meeting (AGM) will be held on Monday, 30th September, 2019 at 706 to 709, Jawala Lane, Off Sodawala Lane, Borivali (West), Mumbai - 400092 to transact such Ordinary business as set out in Notice convening the AGM.

As per Section 108 of the Act read with Rule 20 of Companies (Management and Administration) Rules, 2014 as amended and Regulation 44 of the Securities Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulation 2015, the Company is pleased to provide to its Members, the facility to cast their vote by electronic means on all resolutions set forth in the Notice Convening the AGM.

The details pursuant to the provision of the Act and the said Rules are given hereunder.

1. Date of completion of dispatch of Notice: 7th September, 2019
2. Date and time of commencement of remote e-voting: Thursday, 26th September, 2019 (9.00 a.m.)
3. Date and time of end of remote e-voting: Sunday, 29th September 2019 (5.00 p.m.)
4. Remote E-voting by electronic mode shall not be allowed beyond 5.00 p.m. on 29th September, 2019
5. Cut-off date: 23rd September, 2019.
6. Members who have acquired shares of Company after 23rd August, 2019 which is the date considered for dispatch of the Notice to Shareholders and upto the Cut-off date mentioned above, may obtain their login details for remote by writing to the Company on companysecretary@vaishalipharma.com or to the Share Transfer Agent at the address and contact details mentioned below.

7. The Notice of 34th Annual General Meeting along with Annual Report and the process of remote E-voting along with web link of Annual Report have been sent to all Members through prescribed format and the same is also available on the website of Company and web link of the same is http://www.vaishalipharma.com/pdf/annual_report_2018_2019.pdf and on the website of www.evoting.nsdl.com.

8. The Company shall provide voting for members present at the AGM by the way of Ballot paper.

9. The Members may participate in the AGM even after exercising his right to vote through remote e-voting but shall not be able to vote at the AGM.

10. Only Members who are holding shares of the Company on the cut-off date of 23rd September, 2019, shall be entitled to vote by remote e-voting or at the AGM.

11. For electronic voting kindly log on to e-voting website www.evoting.nsdl.com. Please read the instruction given in the notes to the Notice of the AGM carefully before voting electronically.

For any queries/grievances, in relations to remote e-voting, Members may contact the Company's Registrar and Share Transfer Agent at the below address / telephone Nos: Sharex Dynamic (India) Private Limited, C 101, 247 Park, L.B.S. Marg, Vikhroli (West), Mumbai - 400083. Tel: +91 22 2851 56 06 / +91 22 28 51 56 44 E-Mail: evoting@sharexindia.com.

For Vaishali Pharma Limited
 Sd/-
Jagruti Vasani
 Wholtime Director

KOTHARI WORLD FINANCE LIMITED

CIN: L65993MH1985PLC035005
 Regd Off : C-121, Mittal Tower, Nariman Point, Mumbai - 400021(India)
www.kothariworld.com | Email: info@kothariworld.com
 Tel:+91-22-22851620 Fax: +91-22-22871695 Email: info@kothariworld.com

NOTICE OF 34th ANNUAL GENERAL MEETING, CLOSURE OF REGISTER OF MEMBERS AND REMOTE E-VOTING INFORMATION

NOTICE is hereby given that the 34th Annual General Meeting (AGM) of the Company will be held on Monday, 30th September, 2019 at 09.30 a.m. at 121/C Mittal Tower, 12th Floor, Nariman Point, Mumbai -400021 to transact such Ordinary business as set out in Notice convening the AGM.

The Electronic copy of Annual Report along with the Notice of the AGM, instruction for remote e-voting, attendance slip and proxy form have been sent by Electronic mode to Members whose email IDs are registered with the Company/ Depository Participant. For Members who have not registered their Email IDs with the Company, physical copies of above documents have been sent at their registered address in the permitted mode.

Pursuant to Section 91 of Companies Act, 2013("the Act") read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 that the Register of Members of Kothari World Finance Limited ("The Company") will remain closed from Tuesday, 24th September 2019 to Monday, 30th September 2019 (both days inclusive).

It is also notified that the 34th Annual General Meeting (AGM) will be held on Monday, 30th September, 2019 at 09.30 a.m. at 121/C Mittal Tower, 12th Floor, Nariman Point, Mumbai-400021 to transact the business as set out in Notice convening the AGM.

As per Section 108 of the Act read with Rule 20 of Companies (Management and Administration) Rules, 2014 as amended and Regulation 44 of the Securities Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulation 2015, the Company is pleased to provide to its Members, the facility to cast their vote by electronic means on all resolutions set forth in the Notice Convening the AGM.

The details pursuant to the provision of the Act and the said Rules are given hereunder.

1. Date of completion of dispatch of Notice: 7th September, 2019
2. Date and time of commencement of remote e-voting: Thursday, 26th September, 2019 (9.00 a.m.)
3. Date and time of end of remote e-voting: Sunday, 29th September 2019 (5.00 p.m.)
4. Remote E-voting by electronic mode shall not be allowed beyond 5.00 p.m. on 29th September, 2019
5. Cut-off date: 23rd September, 2019.
6. Members who have acquired shares of Company after 23rd August, 2019 which is the date considered for dispatch of the Notice to Shareholders and upto the Cut-off date mentioned above, may obtain their login details for remote by writing to the Company on companysecretary@kothariworld.com or to the Share Transfer Agent at the address and contact details mentioned below.

7. The Notice of 34th Annual General Meeting along with Annual Report and the process of remote E-voting along with web link of Annual Report have been sent to all Members through prescribed format and the same is also available on the website of Company and web link of the same is http://www.kothariworld.com/pdf/annual_report_2018_2019.pdf and on the website of www.evoting.nsdl.com.

8. The Company shall provide voting for members present at the AGM by the way of Ballot paper.

9. The Members may participate in the AGM even after exercising his right to vote through remote e-voting but shall not be able to vote at the AGM.

10. Only Members who are holding shares of the Company on the cut-off date of 23rd September, 2019, shall be entitled to vote by remote e-voting or at the AGM.

11. For electronic voting kindly log on to e-voting website www.evoting.nsdl.com. Please read the instruction given in the notes to the Notice of the AGM carefully before voting electronically.

For any queries/grievances, in relations to remote e-voting, Members may contact the Company's Registrar and Share Transfer Agent at the below address / telephone Nos: Sharex Dynamic (India) Private Limited, C 101, 247 Park, L.B.S. Marg, Vikhroli (West), Mumbai - 400083. Tel: +91 22 2851 56 06 / +91 22 28 51 56 44 E-Mail: evoting@sharexindia.com.

For Kothari World Finance Limited
 Sd/-
Pradeep K. Kothari
 Director

TOKYO FINANCE LIMITED
 CIN : L65923DD1994PLC009783
 Registered office: Plot No. 363/1 (1,2,3), Shree Ganesh Industrial Estate, Kachigau Road, Daman, Daman and Diu-396210
 Email : info.tokyofinance@gmail.com Website : www.tokyofinance.in

NOTICE of 25th Annual General Meeting, Remote E-Voting Information & Book Closure
 Notice is hereby given that 25th Annual General Meeting (AGM) of the Company will be held on Friday, 27th September, 2019 at 4:15 p.m at Hotel Sovereign, Sea Face Road, Daman-396210 (U.T), to transact the business as listed in the Notice of AGM.

Electronic copies of the Notice of AGM and Annual Report for the year 2018-2019 have been sent to all the members whose email-ids are registered with the Company/Depository Participant. The same is also available on the Company's website www.tokyofinance.in. Physical copies of the Notice of AGM and Annual report for the year 2018-19 have been sent to all other members at their registered address in the permitted mode.

Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 & Rule 20 of The Companies (Management and Administration) Rules, 2014 as amended by The Companies (Management and Administration) Amended Rules, 2015 & Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations & Disclosure Requirements) Regulation, 2015, the Company is pleased to provide all its members (holding shares both in physical and in electronic form) the facility to exercise their vote through remote e-voting to be provided by Central Depository Services (India) Limited (CDSL). The details pursuant to the said Rule are given hereunder:

- a. The remote e-voting shall commence on Tuesday, 24th September, 2019 at 9.00 A.M. and end on Thursday, 26th September, 2019 at 5.00 P.M.
- b. Cut-off date for E-voting is 20th September, 2019.
- c. Any person who becomes member of the Company after dispatch of the Notice of AGM and holding shares as of the cut-off date may obtain the login ID and Password by sending a request at support@sharexindia.com. However if any person is already registered with CDSL for evoting then existing user ID and password can be used for casting vote.
- d. Members may note that :
 (i) Remote e-voting shall be disable by the CDSL after the aforesaid date and time for voting and once the vote is cast, the member shall not be allowed to change it subsequently;
 (ii) The members present at the AGM who has not availed the facility of remote e-voting can vote through 'Ballot papers' at the AGM;
 (iii) The Members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again;
 (iv) A person whose name is recorded in the register of member or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date i.e. 20th September, 2019 only shall be entitled to avail the facility of remote e-voting/voting in the AGM;

e. The Notice of AGM is also available on the Company's website www.tokyofinance.in;
 f. In case of any queries, members may refer the FAQ's and e-voting manual available at the www.evotingindia.com or write an e-mail to helpdesk.evoting@cdslindia.com. Members may also write to the Company at the above mentioned Registered Office address.

g. Notice is hereby given that pursuant to section 91 of the Companies Act, 2013 and Regulation 42 of the SEBI(Listing Obligations & Disclosure Requirements), Regulations, 2015, that the Register of Members and the Share Transfer Book of the company will remain close from the 20th September, 2019 to 27th September, 2019 (both days inclusive) for the purpose of AGM to be held on 27th September, 2019.

For Tokyo Finance Limited
 Sd/-
 Haresh V. Shah
 Director
 DIN: 00008339

Place: Mumbai
 Date: 07.09.2019

TOKYO PLAST INTERNATIONAL LIMITED
 CIN : L25209DD1992PLC009784
 Registered office: Plot No. 363/1 (1,2,3), Shree Ganesh Industrial Estate, Kachigau Road, Daman, Daman and Diu-396210
 Email : info@tokyoplast.com Website : www.tokyoplastint.in

NOTICE of 26th Annual General Meeting, Remote E-Voting Information & Book Closure
 Notice is hereby given that 26th Annual General Meeting (AGM) of the Company will be held on Friday, 27th September, 2019 at 3:30 p.m at Hotel Sovereign, Sea Face Road, Daman-396210 (U.T), to transact the business as listed in the Notice of AGM.

Electronic copies of the Notice of AGM and Annual Report for the year 2018-2019 have been sent to all the members whose email-ids are registered with the Company/Depository Participant. The same is also available on the Company's website www.tokyoplastint.in. Physical copies of the Notice of AGM and Annual report for the year 2018-19 have been sent to all other members at their registered address in the permitted mode.

Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 & Rule 20 of The Companies (Management and Administration) Rules, 2014 as amended by The Companies (Management and Administration) Amended Rules, 2015 & Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations & Disclosure Requirements) Regulation, 2015, the Company is pleased to provide all its members (holding shares both in physical and in electronic form) the facility to exercise their vote through remote e-voting to be provided by Central Depository Services (India) Limited (CDSL). The details pursuant to the said Rule are given hereunder:

- a. The remote e-voting shall commence on Tuesday, 24th September, 2019 at 9.00 A.M. and end on Thursday, 26th September, 2019 at 5.00 P.M.
- b. Cut-off date for E-voting is 20th September, 2019.
- c. Any person who becomes member of the Company after dispatch of the Notice of AGM and holding shares as of the cut-off date may obtain the login ID and Password by sending a request at support@sharexindia.com. However if any person is already registered with CDSL for evoting then existing user ID and password can be used for casting vote.
- d. Members may note that :
 (i) Remote e-voting shall be disable by the CDSL after the aforesaid date and time for voting and once the vote is cast, the member shall not be allowed to change it subsequently;
 (ii) The members present at the AGM who has not availed the facility of remote e-voting can vote through 'Ballot papers' at the AGM;
 (iii) The Members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again;
 (iv) A person whose name is recorded in the register of member or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date i.e. 20th September, 2019 only shall be entitled to avail the facility of remote e-voting/voting in the AGM;

e. The Notice of AGM is also available on the Company's website www.tokyoplastint.in;
 f. In case of any queries, members may refer the FAQ's and e-voting manual available at the www.evotingindia.com or write an e-mail to helpdesk.evoting@cdslindia.com. Members may also write to the Company at the above mentioned Registered Office address.

g. Notice is hereby given that pursuant to section 91 of the Companies Act, 2013 and Regulation 42 of the SEBI(Listing Obligations & Disclosure Requirements), Regulations, 2015, that the Register of Members and the Share Transfer Book of the company will remain close from the 20th September, 2019 to 27th September, 2019 (both days inclusive) for the purpose of AGM to be held on 27th September, 2019.

For Tokyo Plast International Limited
 Sd/-
 Haresh V. Shah
 Director
 DIN: 00008339

Place: Mumbai
 Date: 07.09.2019

PUBLIC NOTICE

NOTICE IS HEREBY GIVEN TO THE PUBLIC AT LARGE THAT the landed property described in the schedule here under written is being developed by M/s. Dinaar Developers having its office at 1146, R. N. Arkade, Nashik Road, Ramzan Nabuu Baugh, Bhiwandi-421302, under the document namely "Deed of Transfer and Assignment of Development Rights" duly registered with Sub-Registrar office at Thane under document no. TNN1-10446-2019 (Slip No.14596) dated 29.08.2019 executed between M/S. Rainbow Projects and Infrastructures, having its office at Shop No. 2, Rehnuma Complex A, Building Opp. Sanjay Nagar, Mumbra, Thane and my clients (1) Abdul Hamid Abdul Aziz Dongre & (2) Mr. Fayed Abdul Hamid Dongre, having their office at 101,102, Farah Baug, A Wing, Next to HP Petrol Pump, Kausa, Mumbra Thane and M/s. Dinaar Developers as above. In terms of above Deed of Transfer and Assignment Development Rights, M/s. Dinaar Developers has acquired all the assignment of the development rights of the schedule property and thereafter to sell and transfer of the Flats/Units to be constructed on said

Registered & Corporate Office :
YES BANK Tower, IFC 2, 15th Floor, Senapati Bapat Marg, Elphinstone (W), Mumbai - 400 013, India.
 Tel.:+9122 3366 9000 Fax : 9122 24214500 Website: www.yesbank.in
 Email : navin.singh@yesbank.in CIN : L65190MH2003PLC143249

Public Notice: Loss of Repossession File

This is to bring to the notice of the general public that the below-mentioned 2 validity expired Repossession files issued by YES BANK Ltd. ("the Bank"), to Vaishnavi Management Pvt. Ltd., have been reported as lost since 12th August 2019. An FIR has been filed with the Sahar Police Station Mumbai on 12th August, 2019 for the same.

Repo kit	Expiry Date	Loan No.	Customer Name	Reg. No.	Engine No.	Chassis No.
2845	10th April, 2019	TWL000100186400	SONIA TRILOK SINGH SONTA	Unregistered	BJ465MS A68001140	MERTN602262 M00036
3528	8th July, 2019	ALN000100179939	SAIDAS KASHINATH PATIL	MH46BA4434	5391676	MA3FNEB1S001 50677

Anyone finding the said Repossession files, is requested to return it to Mr. Navin Singh, YES BANK Ltd., 22nd Floor, IFC 2, Senapati Bapat Marg, Elphinstone (W), Mumbai - 400 013. All the customers of YES BANK Ltd. are hereby notified that the above-mentioned 2 Repossession files have been rendered invalid and not to deal with any person carrying the said Repossession files. Please take further notice that anyone engaging with any person carrying the above-mentioned

